


દ્વારા પ્રચારન પરિવારનું

ફેબ્રુઆરી ૨૦૨૦

પ્રતી પ્રત ભાવ : ₹ ૨૦/-

અકમ એક્સપ્રેસ

પાવર ઓફ
પોર્જિટિવિટી



પાવર ઓફ પોઝિટીવીટી

સંપાદકીય


બાળમિત્રો,

જીવનમાં પોઝિટિવ રહેવાની વાતો તો આપણાને ઘણીવાર શીખવવામાં આવી છે. પણ આ પોઝિટિવ દષ્ટિ કેળવવી કેવી રીતે? અરે, કોઈપણ નાની તકલીફ આવી પડે, ત્યારે આપણો નેગેટિવના પક્ષમાં પડી જઈએ છીએ. આપણું ગમતું ના થયું હોય ત્યારે પોઝિટિવ રહેવું મુશ્કેલ થઈ જાય છે.

જીવનમાં ઉતાર ચડાવ તો આવ્યા જ કરશે. પણ આપણો જો પોઝિટિવ દષ્ટિ કેળવીશું તો વિકટ પરિસ્થિતિને પણ આસાનીથી પાર કરી શકીશું.

આ અંકમાં આપણાને જીવનની દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ શોધીને આનંદમાં રહેવાની સુંદર સમજાણ પ્રાપ્ત થશે.

-ડીમ્પલ મહેતા



અક્ષ્ય એક્સપ્રેસ

Editor : Dimple Mehta

Printer & Published by

Dimple Mehta on behalf of
Mahavideh Foundation
Simandhar City, Adalaj - 382421,
Ta & Dist - Gandhinagar.

Owned by
Mahavideh Foundation
Simandhar City, Adalaj - 382421,
Ta & Dist - Gandhinagar.

Printed at
Amba Offset
B-99, GIDC, Sector-25,
Gandhinagar - 382025.

Published at
Mahavideh Foundation
Simandhar City, Adalaj - 382421,
Ta & Dist-Gandhinagar.

© 2020, Dada Bhagwan Foundation
All Rights Reserved

લાખાન (ગુજરાતી)

વાર્ષિક સમાચાર

મારત : ૨૦૦ રૂપિયા

ચુ.એસ.એ. : ૩૫ ડોલર

ચુ.કે. : ૧૨ ડાઇન

પાંચ વર્ષ

મારત : ૨૦૦ રૂપિયા

ચુ.એસ.એ. : ૫૦ ડોલર

ચુ.કે. : ૧૦ ડાઇન

D.D. / M.O. 'અહિંકેની

કાઉન્સિલ'ના નામે સોકલાં.

વર્ષ : ૧૨, અંક : ૭
સંપાદક અંક : ૧૩૮
ફેબ્રુઆરી ૨૦૨૦

સંપર્ક સ્થળ :
બાળપિણ્ણાન દિનાગ
બિસ્ટિટ સંકુલ, સીનાંદર રીટી,
અમદાવાદ-કોલાં લાંબે,
મુખ્યો. - અદાલત,
ગુ. ગાંધીનગર-૩૮૨૪૨૧, ગુજરાત.
ફોન : (૦૨૬) ૩૬૬૩૦૯૦૦
email:akramexpress@dadbhagwan.org
Website: kids.dadbhagwan.org

ધોરણ બારના રિઝલ્ટની ઉજવણી
કરવા રાજન સરે એમના વિદ્યાર્થીઓને
પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા.

નિષ્ઠગતાના હાયાદા



ચાલને
અમોલ,
નિરાશ
થવાની
શી જરૂર
છે?
પ્લીજ
યાર,
માની જ
ને!



મારે નથી
આવવું. તમે
બધા મજા
કરો. તમારાં
બધાનું
રીજલ્ટ કેવું
સરસ છે
અને મારું
તો...

અમોલના
ગળામાં દૂમો
ભરાઈ ગયો.



અમોલ,
તારું રીજલ્ટ
એટલું
ખરાબ પણ
નથી.
ચાલને
પ્લીજ!
રાજન સર
તને જોઈને
બહુ રાજ
થશે.

અમોલ માની ગયો.

રાજન સરના ઘરે પોતાના મિત્રોના હસ્તા ચહેરાઓ
જોઈને અમોલને કરી પોતાનું રીજલ્ટ યાદ આવ્યું
અને એ ઉદાસ બની ગયો.




અમોલની નિરાશા જોઈને,
ચાલો ફેન્ડ્રસ એક જોક કરું.




રૂમમાં થઈ રહેલો શોર-બકોર શાંત થઈ ગયો.

સરની મજેદાર જોક સાંભળી, રૂમમાં બધા જ પેટ પકડીને હસી પડ્યા. અમોલ પણ.



તો બીજો જોક હો જાયે?



સરે ફરી એનો એ જ જોક કહ્યો. બધાએ ફક્ત એક હળવી સ્માઈલ આપી. સરે વીજી વાર પણ એ જ જોક કહ્યો. આ વખતે કોઈ જ ના હસ્યુ.



અમોલ, આપણને એકના એક જોક પર ફરી ફરી હસવું નથી આવતું. તો પછી એકના એક પ્રોભ્લેમને યાદ કરીને ફરી ફરી દુઃખી કેમ થઈએ?

અમોલ પોતાના હિલની વાત રાજીન સરને કહી.



સર, મારે દુઃખી ના થવું હોય તો પણ લોકો મને દુઃખી કરી દે છે. બધા મને મારું રીઝલ્ટ પૂરીને અફસોસ વ્યક્ત કરે છે.


બેટા, સમુદ્રનું પાણી જહાજની અંદર આવે તો જ એ દૂબે, નહીં તો નહીં.



...એ જ રીતે લોકોની નેગેટિવિટીને આપણી અંદર ધૂસવા દઈએ તો જ એ આપણને દુઃખી કરી શકે, નહીં તો નહીં.




મિત્રો, તમને જગ પ્રસિદ્ધ હેરી પોટર સિરીઝની લેખિકા જે. કે રોલિંગની વાત કહું. આજે તેઓ બ્રિટનની સૌથી પૈસાદાર મહિલાઓમાંના એક ગણાય છે.




પુરા એક અભજ ડોલરથી વધુ સંપત્તિ મેળવનાર રોલિંગને આ સફળતા પ્રાપ્ત કરવા જીવનમાં એમને અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો.



રોલિંગ હાર્વર્ડ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ્થી થનાર વિદ્યાર્થીઓ સમક્ષ 'નિષ્ફળતાના ફાયદાઓ' પર એક લેક્ચર આપ્યું હતું.



ભણતર પૂરું કર્યા પછી, સાત વર્ષ સુધી હું ભયંકર નિષ્ફળ રહી. બેધર બન્યા સિવાય, હોઈ શકે એટલી ગરીબી મેં ભોગવી હતી.



ટાનીએ

૫હે છે...

દાદાશ્રી : પોઝિટિવ વિચારો,
પોઝિટિવ રહો અને પોઝિટિવ બનો.
આપણે જીવનમાં એક પ્રિન્સીપલ રાખવો.
હંમેશા પોઝિટિવ રહેવું, નેગેટિવના પક્ષમાં ક્યારેય
ના બેસવું.

પૂજ્યશ્રી : આ પોઝિટિવિટી પોતાને આનંદ આપે,
નીરોળી બનાવે અને સામાને સુખ આપે. નેગેટિવિટી પોતાને
દુઃખ આપે અને આચપાસવાળાને દુઃખી કરી નાથે.

સાચી સમજણા, સાચા શાનથી પોઝિટિવ તરફ જવાય. શું
બચ્યું એ જુઓ તો પોઝિટિવ રહેવાય. શું ગયું એની રડારડી કરે
એ નેગેટિવમાં પડ્યો કહેવાય.

પોઝિટિવવાળો સવળું શોધીને એડજસ્ટ થઈ
જાય. સમાઈ જાય. નેગેટિવિટી એડજસ્ટ ન ના
થવા હે.


નિશ્ચય મજબૂત કરો કે નેગેટિવના
પક્ષમાં પડવું નથી. હંમેશા જીવનમાં
પોઝિટિવ રહેવું છે. કુદરતનો
નિયમ છે કે ધીમે ધીમે જેવું
નક્કી કર્યું અથી શક્તિઓ
પ્રગટ થાય.




હેલી નંબર જોઈને મૂંજવણમાં છે,
ગ મિત્રો હેલીને સુડોકુનો ઉકેલ
મેળવવામાં મદદ કરો.

				8				
8		9		7	1		2	
4		3	5					1
			1					7
	2			3	4		8	
7	3				9			4
9						7		2
		8	2		5			9
1				4	3			


૨ દર્શાવેલા ચિત્રને ઘટનાક્રમ મુજબ નંબર આપો.




ફ્રાય સામગ્રી પાવડરને
એક બોલમાં ચાણી લો.




ડ્રે ને ઓવનમાં બેક
કરવા માટે મૂકો.



બિસ્કીટ્સ તૈયાર !!



બીજા બોલમાં અન્ય સામગ્રી
અને ફ્રાય સામગ્રીને મિક્સ
કરી લોટ બાંધો.



લોટના લુવાને કુકી કટર વડે
શેપમાં કાપી લો.



બિસ્કીટની સામગ્રી
ભેગી કરો.

3 મને ઓળખો...



ગરમી આપું પણ અંગાર નહીં,
કપડાં બને પણ ક્યાસ નહીં
- રેશમ, ઉન, સુતરાઉ, પ્લાસ્ટિક

૧

સોનાની રાણી, ને સોનામાં સમાણી,
બધાં ચલશા માંણી જેની કિંમત બહુ અંકાણી
- મીની, ગીની, વીની, રીની

૨

૩ તડકો ટાપું, વરસાદ ખાપું એવી છું બળવાન,
રાય અને રંક સહુ હેઠે રાખે, એવું મારું માન
- છત્રી, સ્વેટર, ચંપલ, પંખો

પોલું લાકડું પલક્યું,
ને આપું ગામ જોવા હલક્યું.
- ઢોલ, બોલ, ગોલ, મોલ

૪

બે ભાઈ દોડે પણ પકડાય નહિં
- હરણ, પૈડાં, બસ, દોરડું

૫

હાથ પગ છતાં માણસ નહિં, લાંબી પુંછ પણ ઊંદર નહિં,
જાડ ચેદે તોયે જિસકોલી નહિં, ફળ ખાય પણ પક્ષી નહિં.
- પૂતળું, બિલાડી, વાંદરો, ચાડિયો

૬

૭ મંયકને કોયડો ઉકેલવામાં મદદ કરો.

$$\text{apple} + \text{apple} + \text{apple} = 30$$

$$\text{apple} + \text{banana} + \text{banana} = 18$$

$$\text{banana} - \text{coconut} = 2$$

$$\text{coconut} + \text{apple} + \text{banana} = ?$$



આપતિમાં અવસર



એક અક્સમાતમાં દસ વર્ષના નાનકડા અસીમનો ડાબો હાથ કપાઈ ગયેલો. એક હાથ નહોતો, પણ જૂડો શીખવાની એને ખૂબ જ ઈચ્છા હતી.

“મારો કપાયેલો હાથ જોઈ કોણ મને જૂડો શીખવશે ?” અસીમને આ ડર પજવ્યા કરતો. એક દિવસ હિંમત ભેગી કરીને અસીમ એક ગુરુ પાસે ગયો. એમની આગળ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ગુરુએ એના કપાયેલા ડાબા હાથ તરફ એકાદ ક્ષણ જોયું અને જૂડો શીખવાની હા પાડી દીધી.

બીજા દિવસથી અસીમ જૂડો શીખવા હાજર થઈ ગયો. એ ખૂબ મહેનતુ અને ધગશવાળો હતો. પહેલા દિવસથી જ અસીમ એક પછી એક દાવ શીખવા માંડ્યો. ત્રણ મહિના સુધી આ ચાલ્યું. એ પછી ગુરુએ એને બીજા વિદ્યાર્થીઓથી અલગ પાડી દીધો. હવે ગુરુ એને કેવળ એક જ દાવ શીખવતા. બાકીના વિદ્યાર્થીઓને ઘણાં અવનવા જાત જાતના

દાવપેચ શીખવતા, પરંતુ અસીમને તો દિવસ-રાત કેવળ

એક જ દાવની પ્રક્રિયા કરવી પડતી. એને આશ્રય થતું, મનમાં થતું, ‘ગુરુ કેમ આમ કરતા હશે !’

ઇતાં એ તો ગુરુ જેમ કહે તેમ ઉત્સાહથી પોતાને જે કંઈ શીખવતા એ શીખતો.

એવામાં એ પ્રદેશની સૌથી મોટી જૂડો સ્પર્ધાનું આયોજન થયું. બધા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લેવાનું નક્કી કર્યું. ગુરુએ અસીમને બોલાવી



સ્પર્ધામાં ભાગ લેવા કહ્યું. એને નવાઈ લાગી. એનો એક હાથ તો કપાયેલો હતો. વળી, ગુરુએ તો એને એક જ દાવ શીખવ્યો હતો. એણે ભાગ લેવાની ના પાડી. પરંતુ ગુરુનો કડક આદેશ થતા એણે ભાગ લેવો પડ્યો.

જૂડોની સ્પર્ધા શરૂ થઈ. અસીમ ફાઈનલ સુધી પહોંચી ગયો. ફાઈનલમાં એનો પ્રતિસ્પર્ધી જૂડોનો ખેરખાં ગણાતો. વળી, શરીરમાં હડ્ડો-કડ્બો. જોવાવાળાને થતું કે આવડા ઊંચા મોટા હરિફની સામે એક હાથવાળો જીતે જ કેવી રીતે? સ્પર્ધા દેખીતી રીતે જ એક તરફી હતી. પરંતુ બધાના આશ્રય વરચે સ્પર્ધા શરૂ થવાની બે જ મિનિટમાં અસીમ જીતી ગયો. જોનાર દંગ રહી ગયા. અસીમને પણ આશ્રય થયું કે પોતે કેવી રીતે જીતી ગયો.

ઘરે પાછા ફરતી વખતે અસીમે ગુરુને નવાઈથી પૂછ્યું, “ગુરુજી, મારે એક જ હાથ હતો. વળી, તમે એક જ દાવ બરાબર શીખવ્યો હતો. છતાં, હું કંઈ રીતે આ સ્પર્ધા જીતી ગયો?”

ગુરુ ધીમેથી હસીને બોલ્યા, “દીકરા, તે એક જ એવા દાવ પર શક્તિ મેળવી છે, જે જૂડોમાં સૌથી અધરો દાવ ગણાય છે. અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે. એટલે કે તારો પ્રતિસ્પર્ધી જો તારો ડાબો હાથ પકડે તો જ એ દાવમાંથી છટકી શકે. જે એના માટે શક્ય જ નહોતું. એટલે તારી જીત નક્કી જ હતી.”

અસીમ આશ્રય અને અહોભાવથી ગુરુ સામે જોઈ રહ્યો. ગુરુએ કેવી સહજતાથી એની સૌથી મોટી ખામીને જ એની સૌથી મોટી ખૂબી બનાવી દીધી.

તો મિત્રો, તમારી ઉંશપોથી ગભરાઈને નેગેટિવિટીમાં દૂષ્યા વિના, તમારી ખામીને જ તમારી શક્તિ બનાવી દો. જો પોઝિટિવ રહીશું તો આપત્તિને પણ અવસરમાં પલટી શકવાનું આસાન બની જશે.



જેને તમે અડયણ કહો
છો ‘એ સારી વસ્તુ છે’, એવું
જ્યારે માનશો ત્યારે આગળ
વધાશો. નહીં તો એ અડયણને
‘ખરાબ છે’ એવું તમે કહેશો તો એ
અડયણ તમને અટકાવી દેશે ને
તમારી પ્રગતિ અટકી જશો.



આ તો નવી



જ્યારે કોઈપણ સારી
વસ્તુ વિષે નેગેટિવ વાતો
કરવામાં આવે ત્યારે તે નકામી થઈ
જાય છે. તેવી જ રીતે ખરાબ વસ્તુઓ
વિષે પોઝિટિવ વાતો કરવામાં આવે
ત્યારે તે સારી થઈ જાય છે.




અડ્જસ્ટ એવરીલ્હેર અને
પોઝિટિવીટી વધારનારું
છે.

જ વાત !

આ સ્પીડ બ્રેકશો આવે છે, તો શા
માટે છે ? તમારી સેફટી માટે છે.
માટે આ અડચણો આવે છે તો
તમારા હિત માટે છે.



જીવંત ઉદાહરણ



ગુણ જોવાની દાખિમાં એવી ગજબની તાકાત છે કે ગમે તેવા અવળા સંજોગને પણ બદલી નાંખે છે. તેનો એક જીવંત પ્રસંગ છે. જાપાનની એક એરલાઈન્સ કંપની વિશ્વભરમાં તેના સમય પાલન અને શિષ્ટાચાર માટે પ્રાય્યતાત હતી.

એક દિવસ સંજોગોવશાત્ કોઈ એક કર્મચારીની નાની ભૂલના કારણે દિવસભરના તમામ ઉડ્યનો (વિમાનો)નું ટાઈમ-ટેબલ ખોરવાઈ ગયું. પરિણામ સ્વરૂપે કેટલાક ઉડ્યનો રદ કરવા પડ્યાં. કેટલાક ઉડ્યાં નહીં, તો કેટલાંક મોડાં પડ્યાં. એરલાઈન્સનું વાતાવરણ તંગ થઈ ગયું.

વર્ષોથી ચોક્સાઈભર્યા સમય સાથે ચાલતી આ એરલાઈન્સના ઇતિહાસમાં ક્યારેય આવી પરિસ્થિતિ નહોતી આવી. તાબદતોબ આવી પરિસ્થિતિ સર્જવાનું કારણ શોધવાનું આરંભાયું. આમ કેમ થયું? કોના લીધે આ બન્યું? વગેરેની તપાસ કરતાં સ્પષ્ટ જરૂાઈ આવ્યું કે એક જૂના અને અનુભવી અધિકારીની નાની ભૂલના કારણે આવી વિપરીત પરિસ્થિતિ બની હતી. તપાસ કરનાર અધિકારીઓ હજુ



તેમની ભૂલ બતાવે, તે પહેલાં આ અધિકારીએ જાતે જ પોતાની ભૂલ સ્વીકારી.

પરંતુ એરલાઇન્સની સંચાલક કમિટીને આ ભૂલ માન્ય નહોતી. તરત જ એરલાઇન્સની સમગ્ર સંચાલક કમિટીની મિટિંગ યોજાઈ. મિટિંગના અંતે એ અધિકારીને નોકરીમાંથી કાઢી નાંખવાની સજા નક્કી થઈ. હવે માત્ર આ અધિકારી માટે ડિસમિસ ઓર્ડરની માત્ર બે લીટી જ લખવાની તેથારી હતી. સમગ્ર મિટિંગનું વાતાવરણ ગરમ થઈ ગયું હતું. દરેક સંચાલકના મુખે આ અધિકારી માટે નેગેટિવ શબ્દો જ આવતા હતા. આ સમયે એક પીઠ (સમજદાર) સંચાલકે બધાની વચ્ચે એક પ્રસ્તાવ રજૂ કર્યો કે “આ અધિકારીને ડિસમિસ કરવાના આપણા નિર્ણયમાં કોઈ પ્રકારની ફરી વિચારણા કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પરંતુ જો તમે બધા સંમત હો તો આપણી કંપનીમાં છેલ્લાં ૨૦ વર્ષથી કાર્ય કરતા આ અધિકારીની કામગીરી ઉપર માત્ર બે મિનિટ નજર નાખી લઈએ તો કેમ?” બધાએ મૌન સંમતિ આપી.

થોડીક જ વારમાં તેઓ એરલાઇન્સમાં જોડાયા ત્યારથી આજ સુધીના તેમનાં કાર્યની સફળતાની હકીકતો અને આંકડા કમ્પ્યુટરના સ્ક્રીન પર આવવા લાગ્યા. જેમાં તેમની સફળતાનો આંકડો ઉપર તરફ જતો હતો. કંપની માટે કેટલાંક મહત્વના કાર્યોમાં આ અધિકારી મુખ્ય હતા. તેમણે કંપની માટે આપેલા બલિદાનથી, તેમની કાર્યક્ષમતા અને ગુણાંશી મિટિંગમાં બેઠેલા સૌ સંચાલકોને સજા કરવાના નિર્ણયને બદલે તેમની પ્રયોગ ઉપકારની લાગણી થઈ. સૌ એકબીજા સામે જોઈ રહ્યા અને એકી અવાજે બોલી ઉઠ્યા કે “અરે, આવા અનેક સદ્ગુણ ધરાવનાર કાબેલ અધિકારીને કેમ છોડાય? તેમની તો કંપનીને અને આપણને સૌને ખૂબ જરૂર છે.” માત્ર એક હળવા ઠપકાની નોંધ લખી અને મિટિંગ પૂરી થઈ.

આ હતી અદ્ભૂત તાકાત ગુણ જોવાની દસ્તિની કે જેણે અભાવવાળા વાતાવરણને લાગણીભર્યું બનાવી દીધું. તો મિત્રો, આપણે પણ નક્કી કરીએ કે કોઈનું એક નેગેટિવ દેખાય તો એના અન્ય પોઝિટિવ ગુણોને જોઈને, પોઝિટિવ દસ્તિને કેળવીશું.



Fun Lab



હેતુ:

દાદાશ્રી કહે છે “પોકિટિવિટી ઓટસે શું ? કશું કાટવાનું નહીં, કશું ખાસેંવાનું નહીં, આત્મ સાવવાનું.” તો ચાલો, આ વાક્ય સમજવા માટે આપણે સાયન્ટિફિસ્ટ બનીને ઓફ પ્રોયોગ કરીએ.

સાધનો :

1. એક ગ્લાસમાં રંગીન પાણી (પાણીમાં ઈન્ક અથવા ફૂડ-કલર ઉમેરીને રંગીન બનાવી શકાય)
2. એક ગ્લાસમાં થોડું તેલ
3. એક મોટું વાસણા



<https://kids.dadabhagwan.org/fun-zone/experiment-corner/positivity-removes-negativity/>

આ રીતે કરો:

એટેપ ૧



ઓક ગલાયમાં થોડું તેલ લો અને એ ગલાય
ઓક મોટા વાણામાં મૂકો.

એટેપ ૨



ઓક ગલાયમાં રંગીન પાણી ભરો અને
એ પાણી તેલવાળા ગલાયમાં દેડો.

એટેપ ૩



જેમ જેમ રંગીન પાણી ઉમેરાતું જશે, તેમ તેમ
તેલ ગલાયની બહાર આવવા લાગશે.

એટેપ ૪



છેવટે ગલાયમાંથી તેલ નીકળીને બહાર આવી જશે
અને ગલાયમાં છુક્તા રંગીન પાણી જ રહેશે.

અવલોકન :

તેલ પાણી કરતા ઓછું ગાડ હોવાથી એ પાણી પર તરવા લાગે. જ્યારે પાણીનું
પ્રમાણ વધી જાય ત્યારે બધું જ તેલ ગલાયમાંથી બહાર નીકળી જાય.



તારણ :

તો મિત્રો, દાદાશ્રીએ કહેલી વાત સમજાઈ ગઈ ને ?

રંગીન પાણી એ પોઝિટિવિટી દર્શાવે છે અને તેલ એ નેગેટિવિટી દર્શાવે છે. આપણે
તેલને કાઢવાની મહેનત ના કરી, ફક્ત રંગીન પાણી ઉમેરાવાથી તેલ એની મેળે જ નીકળી
ગયું ! એ જ રીત આપણે આપણા જીવનમાં પોઝિટિવિટી ભરીશું તો નેગેટિવ એની જગ્યા
ઇડોઈને બહાર નીકળી જશે.

મીઠી ટાઈ

અમુક બેનો ભોજનશાળામાં સેવા આપતા. તેઓ આખો દિવસ ગરમીમાં કામ કરતા. નીરુમાને આ વાતની ખબર.

એક દિવસ એમણે બધાને બોલાવ્યા. અમુક પંજાબી ડ્રેસના કાપડ દેખાડતા કહ્યું, “છોરીયો, તમે બધા આખો દિવસ પતરા નીચે કામ કરો છો ને ત્યાં ઉનાળામાં કેટલી ગરમી હોય. આ કોટન મટીરીયલ ખાસ તમારા માટે મંગાવ્યું છે. આમાંથી તમને જે ગમે એ મટીરીયલ લઈ લો.”

કેવું સરસ ! કોણ ક્યાં કામ કરે છે, તેની પરિસ્થિતિ કેવી હશે, કેવી તકલીફો પડતી હશે તે બધું જ નીરુમાને ખબર.


ક્યારેક નીરુમા જોઈ જાય કે રસોડામાં સારા ડ્રેસ પહેર્યા છે તો તેઓ તરત જ કહે, “આપણે રસોડામાં કામ કરતા હોઈએ ત્યારે સાદા કપડાં પહેરવાના. આવા સારા ડ્રેસ ચાલુમાં નહીં પહેરવાના. આવા તો આપણે કોઈ મોટા પ્રસંગો માટે રાખવાના. પ્રતિષ્ઠા હોય કે બહાર શિબિરમાં જઈએ ત્યાર માટે.”

આમ નીરુમા બધાનું જ બધી રીતે સંભાળતા. દુનિયામાં ક્યાંય આવી વ્યક્તિ ના મળે.

‘મા’ કહો તો ‘મા’ ને
કેન કહો તો કેન....!
બધું જ નીરુમા.



મહાવીર ભગવાનની પોજિટિવિટી




મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડયું હતું કે ‘તમે બહાર જાવ ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજયું કે લાકડી એકલી જ મારીને, હાથ તો નથી ભાંગ્યોને ! એટલી તો બચત થઇ !’ એટલે આ જ લાભ માનજો.

કોઈ એક હાથ ભાંગે તો બીજે તો નથી ભાંગ્યોને ! બે હાથ કાપી નાખ્યા ત્યારે જોંગે કે પગ તો છે ને ! બે હાથ ને બે પગ કાપી નાંખે તો કહેયું કે હું જુવતો તો છું ને. આંખે તો દેખાય છે ને ! કોઈ પણ પરિસ્થિતીમાં તું રડીશ નહીં, હસ, આનંદ પામ.

પગલના જવાબ :

1)	<table border="1"> <tr><td>2</td><td>1</td><td>7</td><td>6</td><td>8</td><td>3</td><td>5</td><td>4</td><td>9</td></tr> <tr><td>8</td><td>5</td><td>9</td><td>4</td><td>7</td><td>1</td><td>6</td><td>2</td><td>3</td></tr> <tr><td>4</td><td>6</td><td>3</td><td>5</td><td>9</td><td>2</td><td>8</td><td>7</td><td>1</td></tr> <tr><td>5</td><td>8</td><td>4</td><td>1</td><td>2</td><td>6</td><td>9</td><td>3</td><td>7</td></tr> <tr><td>6</td><td>9</td><td>2</td><td>7</td><td>3</td><td>4</td><td>1</td><td>8</td><td>5</td></tr> <tr><td>7</td><td>3</td><td>1</td><td>8</td><td>5</td><td>9</td><td>2</td><td>6</td><td>4</td></tr> <tr><td>9</td><td>4</td><td>5</td><td>3</td><td>6</td><td>8</td><td>7</td><td>1</td><td>2</td></tr> <tr><td>3</td><td>7</td><td>8</td><td>2</td><td>1</td><td>5</td><td>4</td><td>9</td><td>6</td></tr> <tr><td>1</td><td>2</td><td>6</td><td>9</td><td>4</td><td>7</td><td>3</td><td>5</td><td>8</td></tr> </table>	2	1	7	6	8	3	5	4	9	8	5	9	4	7	1	6	2	3	4	6	3	5	9	2	8	7	1	5	8	4	1	2	6	9	3	7	6	9	2	7	3	4	1	8	5	7	3	1	8	5	9	2	6	4	9	4	5	3	6	8	7	1	2	3	7	8	2	1	5	4	9	6	1	2	6	9	4	7	3	5	8
2	1	7	6	8	3	5	4	9																																																																										
8	5	9	4	7	1	6	2	3																																																																										
4	6	3	5	9	2	8	7	1																																																																										
5	8	4	1	2	6	9	3	7																																																																										
6	9	2	7	3	4	1	8	5																																																																										
7	3	1	8	5	9	2	6	4																																																																										
9	4	5	3	6	8	7	1	2																																																																										
3	7	8	2	1	5	4	9	6																																																																										
1	2	6	9	4	7	3	5	8																																																																										


2)



- 3) 1) ઊન 2) ગીની 3) છત્રી
4) ફોલ 5) પૈડાં 6) વાંદરો

4) 14





એક વાર અર્જુને એક દિવાલ તરફ આંગળી ચીંધતા કૃષ્ણ ભગવાનને કહ્યું, “હે કેશવ, આ દિવાલ પર એવું કંઈક લખો કે સુખમાં વાચ્યું તો દુઃખ થાય અને દુઃખમાં વાચ્યું તો સુખ થાય.”

કૃષ્ણ ભગવાને લખ્યું,

“આ સમય પણ જતો રહેશે.”



અકમ એક્સપ્રેસના સભ્યો માટે સૂચના

૧. આપનું વાર્ષિક લવાજમ પણ થાય છે તે શી રીતે જાણશો? જો આપની આ મહિનાની આવેલ અકમ એક્સપ્રેસના કવરના લેબલ પર મેમ્બરશીપ નં.ની બાજુમાં # હોય તો જાણવું કે આ આપની છેલ્લી અકમ એક્સપ્રેસ છે. દા.ત. AGIA4313 # અને જો આ મહિનાના કવરના લેબલ પર મેમ્બરશીપ નં.ની બાજુમાં # # હોય તો જાણવું કે આ પછીના મહિનાની અકમ એક્સપ્રેસ છેલ્લી અકમ એક્સપ્રેસ રહેશે.

દા.ત. AGIA4313 # #. અકમ એક્સપ્રેસ રિન્યુઅલની વિગત (લવાજમ અને સંપર્કસૂત્ર) ‘સંપાદકીય’ પેજ પર આપેલ છે.

૨.જો આપને કોઈ મહિનાનું અકમ એક્સપ્રેસ ન મળે તો ફોન નં. ૮૧૫૫૦૭૫૦૦ પર નીચેની વિગતો SMS કરવો.

૧) કાર્યી પાવતી નંબર અથવા ID No., ૨) પાકુ એડ્રેસ-પીન કોડ સહિત ૩) જે મહિનાનું મેળેજિન નથી મળ્યું એ મહિનો.



માલિક - મહાવિદેહ ફાઉન્ડેશન વતી પ્રકાશક, મુદ્રક અને તંત્રી - ડિમ્પલ મહેતા દ્રારા
 અંબા ઓફિસેટ - B-99 GIDC, Sector - 25 ગાંધીનગર - ૩૮૨૦૨૫ ખાતે છપાવી પ્રકાશિત કર્યું છે.